



**પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે**

તારીખ ૧૮, એપ્રિલ, ૨૦૧૯ ગુરુવારે સવારે ૧૦.૦૦ કલાકે અમરેલી ખાતે વિશાળ જનસભાને સંબોધશે.

ગુજરાતની જનતાના આશીર્વાદ અને લાખો કાર્યકર્તાઓના પરિશ્રમથી  
ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ભાજપાનું કમળ ખીલશે. - શ્રી જીતુભાઈ વાઘાણી

ગુજરાતના પનોતાપુત્ર અને વિશ્વનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના પુનઃ પ્રધાનમંત્રી બનાવવા માટે  
સમગ્ર દેશ અને ગુજરાતની જનતામાં અનેરો થનગનાટ - શ્રી જીતુભાઈ વાઘાણી

આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તારીખ ૧૮, એપ્રિલ, ૨૦૧૯ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે અમરેલી ખાતે જંગી જાહેર સભાઓને સંબોધશે.

આગામી લોકસભા ચૂંટણી અન્વયે સમગ્ર ભારતમાં કેસરિયો માલોલ પ્રસરી રહ્યો છે ત્યારે ગુજરાતની જનતાના આશીર્વાદ અને લાખો કાર્યકર્તાઓના પરિશ્રમથી ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ભાજપાનું કમળ ખીલશે. ગુજરાતના પનોતાપુત્ર અને વિશ્વનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશના પુનઃ પ્રધાનમંત્રી બનાવવા માટે સમગ્ર દેશ અને ગુજરાતની જનતામાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

**લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિગતવાર કાર્યક્રમ**

તારીખ	સમય	કાર્યક્રમની વિગત
૧૮.૦૪.૨૦૧૯ ગુરુવાર	સવારે ૧૦.૦૦ કલાકે	અમરેલી લોકસભા - જાહેરસભા સ્થળ: કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ મેદાન, સીવીલ હોસ્પિટલની બાજુમાં, અમરેલી

(પ્રશાંત વાળા)

પ્રદેશ કન્વીનર, મીડીયા વિભાગ



કેન્દ્રીય મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજજી  
આવતીકાલે તારીખ ૧૮ એપ્રિલ, ૨૦૧૮ ગુરુવારે ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસે - શ્રી ભરત પંડ્યા

ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે  
ભાજપાની વિજયલહેર ઉમટી રહી હોય તેવો માહોલ સમગ્ર ગુજરાતમાં છવાઈ ગયો છે. - શ્રી ભરત પંડ્યા

આજરોજ ભાજપા પ્રદેશ પ્રવક્તાશ્રી ભરત પંડ્યાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજજી આવતીકાલે તારીખ ૧૮ એપ્રિલ, ૨૦૧૮ ગુરુવારે ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રચાર અંતર્ગત અમદાવાદ ખાતે મહિલા સંમેલન અને જામનગર ખાતે પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

આગામી લોકસભા ચૂંટણી અન્વયે સમગ્ર ભારતમાં કેસરિયો માહોલ પ્રસરી રહ્યો છે ત્યારે આગામી ત્રીજી ચરણની ગુજરાતની લોકસભા ચૂંટણી અન્વયે શ્રીમતી સુષ્મા સ્વરાજજી ગુજરાતમાં વિજળીવેગે પ્રવાસ ખેડી ભાજપાના લોકસભાના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર-પ્રસાર કરશે.

**કેન્દ્રીય મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજજીનો વિગતવાર કાર્યક્રમ**

તારીખ	સમય	કાર્યક્રમની વિગત
૧૮.૦૪.૨૦૧૮ ગુરુવાર	બપોરે ૦૨.૦૦ કલાકે	અમદાવાદ પૂર્વ/પશ્ચિમ લોકસભા - મહિલા સંમેલન સ્થળ - કુશાભાઉ ઠાકરે હોલ, સી.ટી.એમ. અમદાવાદ
	સાંજે ૦૬.૦૦ કલાકે	જામનગર લોકસભા - પ્રબુધ્ધ નાગરિક સંમેલન સ્થળ - ટાઉનહોલ, જામનગર.

(પ્રશાંત વાળા)

પ્રદેશ કન્વીનર, મીડીયા વિભાગ